

M.A. (ECONOMICS) Semester - 1 (CBCS) Examination**Oct/Nov. -2018****INDUSTRIAL ECONOMICS (ELECTIVE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ પ્રો. વિલિયમ જી. બૉમલનો પેઢીનો વેચાણ-આવક મહત્તમીકરણનો સિધ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ ઔદ્યોગિક અર્થશાસ્ત્રનો ખ્યાલ સમજાવો અને તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્રની ચર્ચા કરો.
- પ્રશ્ન-૨ પ્રો. મારીસનો પેઢી વૃદ્ધિનો સિધ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ પેઢીનો અર્થ આપી પેઢીનાં વિવિધ સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ સમજાવો.
- પ્રશ્ન-૩ બજાર માળખાને અસર કરતાં પરિબલોની ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ ખર્ચવત્તાની કિંમતનીતિ વિશે વિગતે સમજૂતી આપો.
- પ્રશ્ન-૪ ઔદ્યોગિક ઉત્પાદકતાનો અર્થ આપી ઔદ્યોગિક ઉત્પાદકતાને અસર કરતાં પરિબલો ચર્ચો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ બજાર પ્રવેશની સ્થિતિ સમજાવો.
- પ્રશ્ન-૫ ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)
(૧) પેદાશ જીવનચક્રનાં તબક્કાઓ સમજાવો.
(૨) પે-બેક પદ્ધતિ.
(૩) બજાર માળખું અને નવ પ્રવર્તન.
(૪) પેઢીના કદ વિકાસનાં લાભાલાભ.

ENGLISH VERSION

- Que-1 Explain the firm's sale income maximization theory of Prof. William J. Baumol. (14)
OR
- Que-1 Explain the concept of industrial Economics and discuss it's nature and scope.
- Que-2 Explain Prof. Marris theory of growth of firm. (14)
OR
- Que-2 Give the meaning of firm and explain the various types of firm and its characteristics.
- Que-3 Discuss the effective factors of market structure. (14)
OR
- Que-3 Discuss in detail the policy of cost plus pricing.
- Que-4 Give the meaning of industrial productivity and discuss the effective factors of industrial productivity. (14)
OR
- Que-4 Explain the entry condition of market.
- Que-5 Write short note. (any two) (14)
(1) Explain the stage of product life cycle.
(2) Pay-Back method.
(3) Market structure and innovation.
(4) The advantage and disadvantage of growth of firm.
